

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૧/૦૨/૨૦૧૭ શનિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૯૦/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૯ કેસ કરી, ૨૭ વ્યક્તિઓને ઝડપી, ૧૫૮ લીટર દેશી દારૂ, ૩૦ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૭૫ વ્યક્તિઓને ઝડપી, રોકડ રૂપિયા ૨,૪૪,૬૪૩/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૯૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૨૯૨/૧૭

જીઆઈડીસી વટવા: મનીષભાઈ ગુણવંતભાઈ ચાંપાનેરી (૨૬. સ્વસ્તીક એપાર્ટમેન્ટ એકતા ટાવર સામે વાસણા) એ તા.૧૦/૨/૧૭ નારોજ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૧/૧૭ કલાક ૧૨/૦૦ થી તા.૫/૨/૧૭ કલાક ૧૧/૦૦ વાગ્યા દરમિયાન જી.આઈ.ડી.સી.વટવા ફેઝ-૧ ખાતે આલ્ફા ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ કંપનીમાં પ્રવેશ કરી એસીડ કિમત રૂપિયા ૧,૮૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

ઘાટલોડીયા: જયદીપભાઈ કરશનભાઈ વાઢેર (૨૬. શશીતા એપાર્ટમેન્ટ આઈ.ઓ.સી.પેટ્રોલપંપની ગલીની સામે મેમનગર) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૪/૨/૧૭ બપોરના ૨/૦૦ થી સાંજના ૫/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી લેપટોપ કિમત રૂપિયા ૧૫,૦૦૦/-, રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- અને જરૂરી કાગળોની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી નરેન્દ્રસિંહ બળવંતસિંહ ચલાવે છે.

સોનાની ચેઇન ખેચી તોડી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૨૯૩/૧૭

ખોખરા: સોનલબહેન સુભાષભાઈ પવાર (ઉ.વ.૧૫) (રહે. જયમંગલપાર્ક વિહલ મંદીરની બાજુમા હાટકેશ્વર સર્કલ પાસે ખોખરા) તા.૧૦/૨/૧૭ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે હાટકેશ્વર રોડ ઉપર આવેલ જૈન મંદીરથી આગળ શાકમાર્કેટ નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા ત્યારે (૨૦ થી ૨૫ વર્ષના આશરાના) ત્રણ અજાણ્યા છોકરાઓ પૈકી એક છોકરાએ સોનલબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- ખેચી તોડી લઈ ત્રણેય નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ સોનલબહેન પવારે ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.સી.પટેલ ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૨૯૪/૧૭

રામોલ: જીતમલભાઈ છીતરમલભાઈ ખટીક (રહે. રામરાજયનગર ખટીક ચાર રસ્તા રામોલ) એ તા.૧૦/૨/૧૭ કલાક ૧/૦૦ વાગે ખટીક ચાર રસ્તા કેશરાજીની દુકાન સામે પોતાની આયસર ગાડી નંબર જી.જે.૧ બી.વી.૨૮૧૫ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી કલાક ૫/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. જેમા ૧૪ ટન ૪૦૫ કિલોગ્રામ લોખંડની એંગલ પટ્ટી કિંમત રૂપિયા ૪,૬૮,૮૨૨/- મતા ભરેલ હતી. આ અંગેની ફરીયાદ જીતમલભાઈ ખટીકે રામોલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.ડી.સોલંકી ચલાવે છે.

સોલા હાઈકોર્ટ: કૃણાલભાઈ ભોગીલાલ પંચાલ (રહે. તીર્થભુમિ સોસાયટી નારોલ ગામ) એ તા.૯/૨/૧૭ સાંજના ૭/૩૦ વાગે સોલા હાઈકોર્ટ સરસ્વતી વિદ્યામંદિર પાસે પાર્કિંગવાળી જગ્યામાં પોતાની હોન્ડા સીટી કાર નંબર જી.જે.૧ એચ.ડી.૪૨૭૦ કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી રાતના ૮/૩૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ કૃણાલભાઈ પંચાલે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એલ.રાજપુત ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૨૯૫/૧૭

માધવપુરા: રાકેશ બાબુભાઈ સંઘવી (ઉ.વ.૩૧) (રહે.ફાઉન્ટેન પ્લાઝા, લક્ષ્મી સિનેમા પાસે, નવસારી) એ અગમ્ય કારણસર તા.૧૦/૨/૧૭ બપોરના ૩/૦૦ વાગ્યા પહેલા કોઈ પણ સમયે માધવપુરા જશરાજ હોટલ બીજા માળે રૂમ નંબર-૨૦૪ માં ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ અંગે માધવપુરા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ધર્મેન્દ્રસિંહ પ્રવિણસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.